

શિયાળાના હવામાનના કોઈપણ ઘટનાની તૈયારીમાં સિટી ઓફ બ્રેમ્પટન

બ્રેમ્પટન, ઓન્ટારિયો (16 જાન્યુઆરી 2020) – સપ્તાહના અંતિમ દિવસોમાં જ્યારે બ્રેમ્પટનમાં આત્યંતિક ઠંડા તાપમાનો અને સ્નોફોલ થવાની આગાહીઓ હોય ત્યારે સિટી સ્મૃતિ કરાવે છે કે શિયાળા માટે તૈયાર રહેવું તે આખી ટીમનો સાગમટો પ્રયાસ હોય છે અને તે દરેક જાણની મદદથી જ શક્ય બને છે કે જથી બધાં માટે તે સુરક્ષિત બની રહે.

શિયાળુ કામગીરીઓ

- કામદારોની ટુકડીઓનું લક્ષ્ય તમામ રસ્તા, સાઈડવોક્સ, ટ્રાન્ઝિટ સ્ટોપ્સ, કોસવોક્સ અને આંટો મારવાની પગથીઓ સ્નોફોલ થયાના 24 કલાકની અંદર સામાન્ય કરી શકાય.
- ગત વર્ષે બ્રેમ્પટનની શિયાળુ કામગીરીઓમાં કાઉન્સિલે મંજૂર કરેલ વધારામાં સામેલ છે સ્થાનિક માર્ગો પર પહેલા 7.5 cm જેટલો બરફનો સંચય થતા કાર્યકારી ટુકડીઓ કામે લાગતી એના બદલે હવે 5.0 cmનાં સંચય પછી જ કાર્યરત કરી સેવા સ્તરો વધારાયા છે એટલેકે શિયાળાની ઋતુની કોઈપણ ઘટનામાં ટુકડીઓ વધુ જલ્દીથી મોકલવામાં આવશે.
- www.brampton.ca/snow પર નવું શરૂ થયેલ પ્લો ટ્રેકર પર નિવાસીઓ હવે જોઈ શકશે કે સિટીના કયા માર્ગો અને કુટપાથો સાફ કરવામાં આવી ચુક્યા છે.

જો આબોહવાનો પ્રકાર આત્યંતિક હશેતો સફાઈ કરવામાં વધુ સમય લાગી શકે. આવી પરિસ્થિતિઓમાં અમે આપણા નિવાસીઓના સહયોગ અને ધીરજની કદર કરીએ છીએ.

નિવાસીઓ માટે સ્મૃતિ અપાવતા મુદ્દાઓ

- સ્નોફોલ થયો હોય તે પછીના દિવસે સવારે 11 સુધીમાં કુટપાથો પરથી બરફ, સ્નો અને સ્વશની સફાઈ કરી દેવી.
- માર્ગો પર પાર્કિંગ કરવાની પરવાનગી નથી અને વિન્ટર વેધરની ઘટનાઓમાં તે અમલી બનાવવામાં આવશે. કૃપા કરીને વાહનો ખસેડી લેશો જેથી પ્લોઝ અને ઈમર્જન્સી વાહનો સુરક્ષિત રીતે પસાર થઈ શકે.
- આપની પાસે સ્ટ્રીટ પાર્કિંગ પરમીટ હોય એવા સંજોગોમાં પણ તે સ્નોફોલ વખતે માન્ય નથી.
- આપના વાહનોથી સાઈડવોક્સને અવરોધશો નહીં તેમજ તેને સ્ટ્રીટ પર રખડતા મુકશો નહીં. આપની કારને આપના ડ્રાઈવવે પર ખસેડશો અથવા ઉપલબ્ધ હોય તો આપના સાઈડવોક્સ અને રોડવેની વચ્ચે આડી પાર્ક કરશો.
- સ્નોફોલ થયા બાદ 24 કલાક પસાર થઈ ગયા હોય તેમ છતાં જો તમારા માર્ગ પર ધ્યાન આપવાની જરૂર લાગે તો 311 પર ફોન કરીને અથવા ઓનલાઈન www.311brampton.ca પર સિટીને જાણ કરશો.
- લાયકાત ધરાવતા વરિષ્ઠો અને વિકલાંગતા ધરાવતા નિવાસીઓ માટે સ્નો દૂર કરવા માટે નાણાકીય સહાય ઉપલબ્ધ છે. વધુ જાણકારી મેળવો: <http://ow.ly/D2R050xgPq2>.

- During extreme cold weather, take extra safety precautions if going outside. સલામતી/સુરક્ષા પૂર્ણ સૂચિ માટે અહીં મુલાકાત કરો: <http://ow.ly/sXzo50xXv7B>.

મનોરંજન

રજિસ્ટર્ડ વર્ગો અને ડ્રોપ-ઇન પ્રોગ્રામ્સના સમયપત્રકોના અપડેટ્સ માટે કૃપા કરીને તમારા સ્થાનિક રિક્રિએશન સેન્ટરનો સંપર્ક કરો અથવા www.brampton.ca/recreation ની મુલાકાત લો.

સ્કેટિંગ ટ્રેઇલ્સ

ગેજ પાર્ક સ્કેટિંગ ટ્રેઇલ (Gage Park Skating Trail), ચિંગ્વુકુઝી પાર્ક સ્કેટ ટ્રેઇલ (Chinguacousy Park Skate Trail), ગોર મેડોઝ (Gore Meadows) સ્કેટિંગ રિંક, અને માઉન્ટ પ્લેઝન્ટ આઉટડોર સ્કેટિંગ રિંક (Mount Pleasant Outdoor Skating Rink)ના અપડેટ્સ માટે મુલાકાત લો www.brampton.ca/skating.

ટ્રાન્ઝિટ

શિયાળુ ઘટના થવાના પ્રસંગે, કેટલાક બ્રેમ્પટન ટ્રાન્ઝિટ રૂટ્સ હવામાનની પરિસ્થિતિઓથી અસરગ્રસ્ત થઈ શકે. કૃપા કરીને પ્રવાસમાં વધુ સમય લાગશે તેવી ગણતરી રાખશો. અપડેટ્સ માટે, Twitter પર [@BramptonTransit](https://twitter.com/BramptonTransit) ને ફોલો કરશો અથવા અહીં કોલ કરો 905.874.2999.

સ્નોની સફાઈ વિષયક અપડેટ્સ અને માહિતી

- સ્નોની સફાઈના અપડેટ્સ માટેમુલાકાત લો www.brampton.ca/snow અથવા સિટી ઓફ બ્રેમ્પટનને [Twitter](https://twitter.com/BramptonTransit) અને [Facebook](https://www.facebook.com/BramptonTransit) પર ફોલો કરો.
- શિયાળુ સુરક્ષા સૂચનો માટે www.brampton.ca/prepared ની મુલાકાત લો.
- ફોનથી 311 પર સંપર્ક કરો, [email](mailto:311@brampton.ca) પર, થવા નવી બ્રેમ્પટન 311 મોબાઇલ એપ પર (Google Play અને App Store પર મળી રહેશે) અને [website](http://www.brampton.ca/311) પર એવા સંજોગોમાં જ્યારે શિયાળુ કામગીરીઓની તાકીદની પરિસ્થિતિ હોય.

-30-

મિડિયા સંપર્ક:

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca